https://archive.org/details/bk1048/page/n0/mode/1up
-Ambala and Vigodi Sanatani Meeting (1048)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

KJ-BK-3-26

સં. ૨૦૦૨ ના. ફાગણ સુદ ૫ ઈ[૧૨] ને રવિવારના રોજ મુ. આંબાળા મુકામે શ્રી
મુ. કડવા પાટીદાર સનાતન સમાજની જાહેર સભા મળી હતી. તેમાં આશરે ૪૦૦ માણસો ભેગા થયા હતા. તે સભામાં થએલ કાર્ય નીચે
મુજબ

૧ ઈશ્વરની પ્રાર્થના પુષ્પદન્તાચાર્યકૃત શિવમહિમ્ન સ્તોત્રથી શરૂ કરવામાં આવ્યું હતું
૨ આંબાળા ગામના પટેલ પ્રમુખ તરીકે [illegible] નિમાયા હતા. તેમણે ટેકો આપ્યો. પ્રમુખશ્રી ઉપરાંત મુ. રતનજી ના પટેલ
[illegible] હતા. જેને ટેકો આપ્યો આંબાળાના પટેલ [illegible]
એ આપેલ હતો. તે બાદ પ્રમુખ [illegible] ગામના રતનજી લાલજી [illegible] આભાર [illegible] હતા તેમ
પ્રમુખના [illegible] સુચના રજુ કરી હતી.
૩ તે બાદ [illegible] ધર્મ [illegible]
મનુષ્યના [illegible] — [illegible] — [illegible] — સાધુ [illegible] — [illegible]
[illegible] — [illegible] શુદ્ધિ [illegible] — [illegible]
[illegible] — સનાતન ધર્મ [illegible]
[illegible] — [illegible]
[illegible] ધર્મ [illegible]
[illegible] હતું. — તાળીઓ
૪ [illegible] આંબાળા ગામના [illegible]
[illegible] હતા. [illegible] ઉપર [illegible] તાર
[illegible] કર્યું હતું [illegible]
આપણી જ્ઞાતિના [illegible] આપણી જ્ઞાતિના [illegible]
[illegible] સનાતન ધર્મ [illegible]
[illegible]
[illegible] તાળીઓ
૫ [illegible] હતા. [illegible]
[illegible] ગુજરાત [illegible] કડવા પાટીદાર [illegible]
[તાળીઓ]
જનરલ [illegible] આપણે [illegible] ગુજરાત [illegible]
[illegible] આપણી જ્ઞાતિ [illegible]
[illegible] વગેરે વગેરે. તાળીઓ
૬ [illegible] રતનજી [illegible]
[illegible]
[illegible] છે. [illegible]
[illegible] છે. [illegible]
[illegible] સનાતન ધર્મ [illegible]

https://archive.org/details/bk1048/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

VSA: 03-Sep-1945
Date recorded as per Kutchhi
Calendar in which new year
starts with Ashadh month

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 16:30:25 +05'30'

Real Patidar
Unravel Truth

પ્રકરણ ૨૮

KJ-BK-3-26

realpatidar.com

સં. ૨૦૦૨ ના. શ્રાવણ વદ ૧૨ ને સોમવારના રોજે મું. અંબાલા મુકામે મું. કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ ના વિગોડી ગામે (નિરધારમાં આવેલ જેમાં ઘણાખરા ગામોના પટેલો મળી ૪૦૦ આસરે માણસ હાજર હતા. તે સભામાં થયેલ કાર્યવાહી નીચે મુજબ.

૧ પ્રમુખ સ્થાનના પ્રસ્તાવ. પુંજાભાઈ ધનજીભાઈ એ કરેલ ને ટેકો આપેલ ... સર્વાનુમતે પાસ થયું.

૨ પ્રમુખ સ્થાનમાં પટેલ નથુ નાનજી એ ... કરોડ ના. ... ગામ મું. ... ના પટેલ ... મુજબ ના મુકી હતી. જેના ટેકામાં ... ના પટેલ ... હતા. તે બાદ પ્રમુખ ... મુજબ ને ... બાદ તેમના ... ગામ મું. ... પ. રતનશી ... સભાનો ઉદ્દેશ ... જ્ઞાતિ હિત ... પ્રમુખના ... રજુ કર્યા હતા.

૩ તે બાદ મું. ... – સ્વામી ઉમેદ શરણ વિજય થયા હતા. ને તેમને ધર્મ ... મનુષ્યના ફરજ – ... – સાધુ ના ફરજ શુ. – ... પાપ – ... શુદ્ધિ ... શુદ્ધિ કાર્ય ના ... – ... ગુરૂ ... – સનાતન ધર્મ ... – ... – પર ... – ... છે – તેના ... દાન છે – ... ધર્મ ... જ્ઞાતિને ... અસરકારક ... કર્યું હતું. — તાળીઓ

૪ ... પટેલ નથુ નાનજી એ ... ગામના ... ના ... કોઈ ... લોક પ્રયત્ન કરેલ હતા. ને જ્ઞાતિ હીત ... અસરકારક ... કર્યું હતું. આપણા જ્ઞાતિમાં ... આપણા જ્ઞાતિ ના ... આપણા જ્ઞાતિના ... શુભ કાર્યમાં ... સનાતન ધર્મ ... લોક ... ઉપર. ... આપણા ... સહાર ... જ્ઞાતિના ... છે – વગેરે ... તાળીઓ

૫ ... કરશન ... હતા. ... આપણે ... ગુજરાત વગેરે ... તપાસ ... આપણી કડવા પાટીદાર ... (ઉપરાંત) ... આપણે ... ગુજરાત ... એ ... આપણા જ્ઞાતિમાં ... કાર્ય ... વગેરે વગેરે. તાળીઓ

૬ ... મું. રતનશી ... હતા ... આ જ્ઞાતિને ... છે ... છે ... છે. ... છે – ... જ્ઞાતિના ... સનાતન ધર્મ ...

realpatidar.com

https://archive.org/details/bk1048/page/n3/mode/1up

તે. પરણે. ઈઈ શુદ્ધ કરવા. ને [illegible] તેને તે રીતે જ્ઞાતિના [illegible]
કરવા [illegible] કર્યું નહિ [illegible] ધર્મ [illegible] જ્ઞાતિના [illegible]

realpatidar.com

[illegible] ... આ જ્ઞાતિના [illegible] સનાતન ધર્મ માટે
[illegible] જરૂર પડે તો [illegible] છે. [illegible]
[illegible] જ્ઞાતિ [illegible]
ને [illegible] સનાતન ધર્મ [illegible]
[illegible]
[illegible] જ્ઞાતિને [illegible]
[illegible] જ્ઞાતિનો [illegible]
[illegible] જ્ઞાતિનું [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

પ્રમુખ [illegible] —
[illegible] —
[illegible]
[illegible]
[illegible]
[illegible]

જ્ઞાતિ સેવક
[illegible]

VSA: 04-Sep-1945

શ્રા. ૨૦૦૧ ના. શ્રાવણ વદ. ૧૩ ને સોમવાર ના. રોજ આપણી જ્ઞાતિના [illegible]
[illegible] આપણી જ્ઞાતિના કેટલાક. આગેવાન ભેગા [illegible]
વિગોડી વાળા [illegible] હરજીભાઈ [illegible]

realpatidar.com

[illegible] વિગોડી [illegible]
[illegible] વિગોડી [illegible]
ને વિગોડી [illegible] સનાતન ધર્મ માટે [illegible]
[illegible]
[illegible]
[illegible] સનાતન ધર્મ [illegible]
[illegible]
[illegible]
[illegible]

https://archive.org/details/bk1048/page/n4/mode/1up

३०　KJ-BK-3-28

એ વધઘટ કરશે. તે બાદ આમના મુખ્ય આગેવાનો એ આ સનાતન ધર્મ
અંગે જુદા જુદા છાપે તેમજ [illegible] ભાષણ થયું હતું. તે બાદ અમો ભાઈ
રતનશી તથા નથુ નાનજી [illegible] તરફે [illegible] કર્યા [illegible]
[illegible]

તે બાદ [illegible] [illegible] આવ્યા [illegible] તે [illegible] થયું [illegible]
મુલાકાત થઈ ને તેમનો [illegible] [illegible] કરી [illegible]
[illegible]
[illegible] શનાતન [illegible]
[illegible]
ને [illegible] શનાતની [illegible]
[illegible]
તે [illegible] શનાતન
[illegible]
[illegible] તે બાદ [illegible] શનાતન ધર્મ
[illegible]
તે બાદ [illegible] [illegible]
[illegible]
[illegible] તરફે [illegible]

[illegible]
[illegible] નથુ [illegible]